

78 78 5 91 0 92 પર GK લખી વોટ્સએપ પર સેન્ડ કરો.

**Current affairs 13 (2) સામાન્ય જ્ઞાન 3-3-2017**

**Page-1**

## રાષ્ટ્રીય

૧) ભારત દ્વારા સ્વદેશ નિર્મિત સુપર સોનિક ઈન્ટરસેપ્ટર મિસાઈલનું એક મહિનામાં બીજીવાર સફળ પરીક્ષણ કરેલ છે.

૨) મહારાષ્ટ્રની રાજ્ય સરકાર પારંપારિક બળદગાડાની રેસ રાજ્યમાં ફરી શરૂ કરવા માટે કાયદામાં સુધારો કરવા માટે પ્રયાસ કરશે.

૩) વિશ્વના સૌથી અમીર શહેરોમાં મુંબઈને એકવીસમું સ્થાન આપવામાં આવેલ છે.

૪) ભારતના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીઝે એક અઠવાડિયામાં 10 નવા અગ્રીમ મુલ્ય નિર્ધારણ સમજુતીઓમાં પ્રવેશ કરેલ છે.

૫) જાણીતા પોલીસ અધિકારી ડી.આર.ડોલી બર્મનને હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીના નિર્દેશક તરીકે નિયુક્ત કરાયા છે.

૬) વર્લ્ડ બેંકે ઝારખંડ રાજ્યમાં તેજસ્વીની પરિયોજના અંતર્ગત 6.8 લાખ યુવતીઓને સશક્ત બનાવવા માટે 6.3 કરોડ રૂપિયાનું ઋણ મંજૂર કરેલ છે.

૭) હાલમાં ભારતીય રીઝર્વ બેંકે સાઈબર ખતરા પર એક અંતર અનુશાસનાત્મક સ્થાઈ સમિતિની રચના કરેલ છે.

૮) હાલમાં સુદીપ લખટકીયાને સી.આર.પી.એફ.ના મહાનિર્દેશક તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવેલ છે.

૯) અસમની રાજ્ય સરકારે ઉચ્ચ વિદ્યાલયોમાં સાફ-સફાઈ પર નજર રાખવા માટે એક વિશેષ શિક્ષકની નિયુક્તિ માટેનો નિર્ણય લીધેલ છે.

## આંતરરાષ્ટ્રીય

૧૦) ભારત અને યુકેન દેશ સિનેમાના માધ્યમથી બંને દેશોની વચ્ચે ઢિપક્ષીય સહયોગ મજબૂત બનાવવા માટેની સમજુતી સાધવામાં આવેલ છે.

3-3-2017

૧૧) અમેરિકાના નવા રાષ્ટ્રપતિ હાલની લોઅર સ્કીલ્ડ ઈમિગ્રેશનની સિસ્ટમને બદલે મેરીટ આધારિત સીસ્ટમ લાવશે.

૧૨) ચીનમાં વર્ષ 1979 માં વધતી વસતિને નિયંત્રણમાં રાખવા એક સંતાનની નીતિ અમલમાં મૂકી હતી.

૧૩) યુરોપ ખંડના એટના જ્વાળામુખીમાં 25 વર્ષનો સૌથી મોટો પ્રચંડ વિસ્ફોટ થયેલ છે.

## ગુજરાત

૧૪) 2 માર્ચ 2017 ના રોજ ગુજરાતના કવિ કાગની 40 મી જન્મ જયંતિ પ્રસંગે કવિ કાગબાપુ લોકસાહિત્ય એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.

## રમત-જગત

૧૫) આઈ.એસ.એસ.એફ.વર્લ્ડકપમાં જીતુરાયે પુરુષોની 50 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડમેડલ મેળવેલ છે.

૧૬) ભારતની ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આ વર્ષે ઇન્ડિયન બોક્સિંગ લીગનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે.

૧૭) હાલ મહિલા હોકી ઇન્ડિયાના નવા કોચ બનેલા નેધરલેન્ડના શોર્ડ મારિનનો કાર્યકાળ ચાર વર્ષનો રહેશે.

## અન્ય

૧૮) તાજેતરમાં સુમિત મલિકને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

૧૯) મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ તરીકે સ્વાધીન ક્ષત્રિય ફરજ પર હતા, તેનો કાર્યકાળ 31 જાન્યુઆરીના રોજ પૂર્ણ થતો હતો પરંતુ તેને એક માસ વધારે લંબાવવામાં આવેલ.

૨૦) સૈમસંગ કંપનીએ વિશ્વના પ્રથમ સૌર ઉર્જા સંચાલિત રેફ્રીજરેટરની શરૂઆત કરેલ છે.

3-3- 2017

## સમીક્ષા 215 (1) તારીખ 3/3/2017

### વિશ્વ વ્યાપાર સંગઠનમાં જે.એસ. ટીપક ભારતના આગળના રાજદૂત તરીકે નિયુક્ત કરાયા...

- ૧) દુરસંચાર સચિવ જે.એસ.ટીપકને આ વર્ષે જુનથી ભારતના આગળના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- ૨) ઉત્તરપ્રદેશ કૈડરના 1982 ની બેન્ચના આઈ.એ.એસ. અધિકારી ટીપકને તાત્કાલિક અસરથી દુર સંચાર વિભાગથી હટાવવામાં આવેલ છે.
- ૩) તેઓને વાણીજ્ય વિભાગમાં વિશેષ કાર્યાધિકારી બનાવવામાં આવ્યા છે.
- ૪) હાલ તેઓ બાર્સિલોનામાં આયોજિત થઈ રહેલા વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસમાં છે.
- ૫) જ્યારે તેઓ પૂર્વ વાણીજ્ય મંત્રાલયમાં હતા ત્યારે ડબલ્યુ.ટી.ઓ. અને 16 દેશો થી જોડાયેલા મુક્ત વ્યાપાર સમજૂતીમાં ભારતના મુખ્ય સમજૂતીકાર રહ્યા હતા.
- ૬) આધિકારીક આદેશ અનુસાર તેમનું પ્રમોશન કરીને નિર્દેશક માંથી સચિવ બનાવવામાં આવ્યા છે.
- ૭) અને હવેથી તેઓ વાણિજ્યિક વિભાગમાં ઓ.એસ.ડી. તરીકેની ફરજ નિભાવશે.

– પરેશ ચાવડા

3-3- 2017

રોજે- રોજ આપના ફોનમાં જી.કે, કન્ટ અફેર્સ મેળવવા નીચેની લીંક પરથી એપ ડાઉનલોડ કરો.

<https://play.google.com/store/apps/details?id=com.edusafar>

ગુજરાતી વ્યાકરણ દર્શક સર્વનામ અને તેના પ્રકારો ગુજરાતી વિડીયો-6 નીચેની લિંક પરથી જુઓ.

<https://www.youtube.com/watch?v=2nsGH2ugEp4>

ફોટો શોપમાં ટાઈટલ કેમ બનાવવું , ગુજરાતી વિડીયો નીચેની લિંક પરથી જુઓ.

<https://www.youtube.com/watch?v=H94XsZbJTMQ>

ગણિત, ઘોરણ 10 નું પ્રકરણ 11 ના મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન સોલ્યુશન ગુજરાતી વિડીયો માટે .

<https://www.youtube.com/watch?v=otgzApN9FOQ>

ગણિત નફો-ખોટ ભાગ -3 ગુજરાતી વિડીયો જુઓ નીચેની લિંક ઓપન કરો.

<https://www.youtube.com/watch?v= ExaD8EcBog>

બેસ્ટ જીકે વિડીયો માટે નીચેની લીંક ઓપન કરો.

[https://www.youtube.com/channel/UCfDAM9P2RF\\_ynz8B\\_j5enC](https://www.youtube.com/channel/UCfDAM9P2RF_ynz8B_j5enC)

મિત્રો, એજ્યુસફર દ્વારા **GK** ના વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે આ માટે **YouTube** પર જઈ, **EduSafar** લખી સર્ચ કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી **GK** વિડીયો ના નવા અપડેટ્સ મેઈલ પર મળતા રહેશે.